

અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન  
યોજનાનો લાભ આપવા અંગેની  
વિગતવાર સૂચનાઓ

ગુજરાત સરકાર  
નાણા વિભાગ  
ઠરાવ ક્રમાંક: નવપ/૧૦/૨૦૨૦/ઓ-૬૪૦/૩૮  
સચિવાલય, ગાંધીનગર.  
તા.૧૯/૦૪/૨૦૨૫

### વંચાણો લીધાઃ

(૧) નાણા વિભાગનો તા.૦૮/૧૧/૨૦૨૪ નો ઠરાવ ક્રમાંક: નવપ/૧૦/૨૦૨૦/ઓ-૬૪૦/૩૮

### આમુખઃ

વંચાણ હેઠળના ક્રમાંક (૧) મુજબ રાજ્યમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા માન્ય ભરતી બૉર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફત કોઈ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય પરંતુ તા.૦૧/૦૪/૨૦૦૫ પછી નિમણૂક પામેલ હોય તેવા તેમજ તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામી તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયા હોય અને તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવેલ છે આ અંગેની વિગતવાર સૂચનાઓ બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી. પુષ્ટ વિચારણાના અંતે તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવની વિગતવાર સૂચનાઓ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

### ઠરાવઃ

#### (અ) અધિકારી/કર્મચારીઓ દ્વારા અનુસરવાની કાર્યપદ્ધતિ :-

૧. તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા નીચે મુજબ આધાર પુરાવા સાથે ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી ૩(ત્રણ) માસમાં અરજી કરવાની રહેશે.

(ક) ચાલુ નોકરીના ડિસસામાં અધિકારી/કર્મચારી હાલ જે વિભાગ/કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગ/કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

સાથે પણ.

(ખ) નિવૃત્ત થયેલ હોય તેવા કિસ્સામાં અધિકારી/કર્મચારી જે વિભાગ/કચેરીમાંથી નિવૃત્ત થયેલ હોય તે વિભાગ/કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

(ગ) અધિકારી/કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેઓના કાયદેસરના વારસદારો ઢારા, અવસાન પામનાર અધિકારી / કર્મચારી જે વિભાગ/કચેરી ખાતે ફરજ બજાવતા હતાં તે વિભાગ/કચેરી ખાતે આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

(ધ) જે અધિકારી/કર્મચારી પ્રથમ નિમણુંકની સેવા પરથી ફરજ મુક્ત થઈ/ટેકનીકલ કારણોથી રાજીનામું આપી અન્ય સંવર્ગમાં નિયમિત નિમણુંક પામેલ હોય તો, તેઓ હાલ જે વિભાગ/કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગ/કચેરી ખાતે અરજી કરવાની રહેશે.

૨. તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવનો લાભ મેળવવા માંગતા તેમજ પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારીઓએ તેઓની હાલની કચેરી ખાતે ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી ૩(ત્રણ) માસમાં વિકલ્પ આપવાનો રહેશે અન્યથા તેઓને નવી વધિત પેન્શન ચોજનામાં ચાલુ રાખવામાં આવશે. અધિકારી/કર્મચારી એક વખત આપેલ વિકલ્પને આખરી ગણવાનો રહેશે. ઉક્ત વિકલ્પની સેવાપોથીમાં અવશ્ય નોંધ કરવાની રહેશે. (Form-A અનુસાર)

૩. અધિકારી/કર્મચારીઓએ આ સાથે સામેલ વિકલ્પ ફોર્મ - A, બાંહેદરી નમૂના (પત્રક-ગ), પ્રોવિડન્ટ ફંડમાં જોડાવા માટેની અરજીનો નમૂનો (પત્રક-ઘ) તેમજ સામાન્ય નિયુક્તિ ફોર્મ-૧ અરજી સાથે રજૂ કરવાનું રહેશે.

### **(બ) વિભાગ /ખાતાના વડા કક્ષાએ અનુસરવાની કાર્યપદ્ધતિ :-**

૧. અધિકારી/કર્મચારીઓ તરફથી મળતા વિકલ્પના આધારે તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારીઓની વિભાગો/ખાતાના વડાએ ઓળખ કરી ચાદી બનાવવાની રહેશે.

૨. તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવ મુજબ લાભાર્થી તરીકે પાત્રતા ધરાવતા હોય ઉક્ત કેસો પૈકી અવસાન પામેલ, નિવૃત્ત થયેલ અને એક વર્ષમાં નિવૃત્ત થનાર હોય તેવા કેસોને વિભાગે અગ્રતા આપવાની રહેશે. ઉક્ત કેસોમાં વિભાગો ઢારા પેન્શન કેસ/ પેપર પણ તૈયાર કરી અગ્રતાના ધોરણે નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને રજૂ કરવાનાં રહેશે.

૩. તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કેસોમાં ઠરાવ મુજબના લાભો મેળવવા માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

૪. તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવના ફકરા-૧ ના મુદ્દા (અ) અને (બ) મુજબના જે અધિકારી/કર્મચારી પ્રથમ નિમણુંકની સેવા પર જ કાર્યરત હોય તેવા કેસોમાં વહીવટી વિભાગ/ખાતાના વડાએ અધિકારી/કર્મચારીની પાત્રતા અંગે પૂરતી ચકાસણી કરી વિગતવાર હુકમો કરવાના રહેશે. જેની નોંધ સંબંધિત અધિકારી/કર્મચારીની સેવાપોથીમાં અવશ્ય કરવાની રહેશે.

આદ્યતા

ખ. તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવના ફકરા-૧ ના મુદ્દા (ક) (૧) મુજબના જે અધિકારી/કર્મચારી પ્રથમ નિમણૂંકની સેવા પર જ કાર્યરત હોય તેવા કેસોમાં વહીવટી વિભાગ/ખાતાના વડાએ અધિકારી/કર્મચારીની પાત્રતા અંગે પૂર્તી ચકાસણી કરી વિગતવાર હુકમો કરવાના રહેશે. જેની નોંધ સંબંધિત અધિકારી/કર્મચારીની સેવાપોથીમાં અવશ્ય કરવાની રહેશે.

ગ. તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવના ફકરા-૧ ના મુદ્દા (અ), (બ) અને (ક) (૧) મુજબના જે અધિકારી/કર્મચારી પ્રથમ નિમણૂંકની સેવા પરથી ફરજ મુક્ત થઈ/ટેકનીકલ કારણોથી રાજીનામું આપી અન્ય સંવર્ગમાં નિયમિત નિમણૂંક પામેલ હોઇ તેવા કેસોમાં સંબંધિત કચેરીએ અધિકારી/કર્મચારીની સેવા સળંગ કરવા અને તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવના લાભો આપવા અંગેના કેસોમાં સંબંધિત વિભાગ મારફત વિભાગના વડા કક્ષાએ અધિકારી/કર્મચારીની પાત્રતા અંગે પૂર્તી ચકાસણી કર્યા બાદ જ નાણા વિભાગને દરખાસ્ત કરવાની રહેશે. નાણા વિભાગ છારા સેવા સળંગ અને જૂની પેન્શન યોજનામાં જોડાવાની મંજૂરી આપ્યા બાદ વહીવટી વિભાગ છારા વિગતવાર હુકમ કરવાના રહેશે તેમાં ઉક્ત હુકમ નાણા વિભાગની મંજૂરીથી કરવામાં આવેલ છે તેનો સ્પષ્ટ ઉદ્દેખ કરવાનો રહેશે. આ બાબતની નોંધ સેવાપોથીમાં અવશ્ય કરવાની રહેશે.

૪. ત્યારબાદ, સંબંધિત વિભાગ/કચેરીઓ છારા કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) ખાતા ખોલાવવા પત્રક-ખ અનુસાર, સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) ના હિસાબો નિભાવનાર સંબંધિત સંસ્થાને નિયત નમૂનામાં દરખાસ્ત કરવાની રહેશે. આ દરખાસ્ત વિભાગ છારા અધિકારી/કર્મચારીને જૂની પેશનના લાભો આપવા કરેલ હુકમની તારીખથી એક માસની અંદર કરવાની રહેશે. સંબંધિત સંસ્થા છારા ફાળવાયેલ સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) ખાતા નંબરની સેવાપોથીમાં અવશ્ય નોંધ કરવાની રહેશે અને નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિન્ટ ફંડની કચેરીને તેની જાણ કરવાની રહેશે.

૫. સંબંધિત વિભાગ/કચેરીઓએ અધિકારી/કર્મચારીના NPS ખાતામાં જમા રકમ સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) ખાતામાં તબદીલ કરવા માટે નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિન્ટ ફંડની કચેરીને વિગતવાર દરખાસ્ત નીચે મુજબના દસ્તાવેજો સહ કરવાની રહેશે.

૬. વિભાગ/કચેરીનો NPS માંથી GPF ફંડ ટ્રાન્સફર કરવા અંગેનો ફોરવર્ડિંગ લેટર જેમાં PRAN/PPAN નંબર અચૂક દર્શાવેલા હોવા જોઈએ.

૭. વિભાગ છારા નાણા વિભાગની મંજૂરી મળેવી જૂની પેન્શન/ સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) માં સમાવેશ કર્યા અંગેનો હુકમ

૮. સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) નંબર ફાળવ્યા અંગેનો હુકમ

૯. સંબંધિત કચેરીઓએ ઉક્ત બાબતે નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિન્ટ ફંડની કચેરીને જે તારીખે દરખાસ્ત કરવામાં આવે અથવા સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) ખાતું ખોલવામાં આવે ત્યારપણીના

સાચા

સમયગાળામાં બનનાર પગારબીલમાં તે કર્મચારીના NPS શિડયુલમાં કપાત ન થાય તેની ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત ઉપાડ અને વહેચણી અધિકારીની રહેશે.

#### (ક) નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ અનુસરવાની કાર્યપદ્ધતિ :-

૧. નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ NPS ખાતા બંધ કરવા માટે PROTEAN-CRA (formerly known as NSDL)ના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

૨. PROTEAN-CRA તરફથી મળેલ રકમ પૈકી કર્મચારી ફાળો અને તેના પર મળેલ વળતર તેમજ સરકારી ફાળો અને તેના પર મળેલ વળતરની રકમ "પત્રક-ખ" માં દર્શાવ્યા મુજબ વિવિધ બજેટ સદર હેઠળ જમા લેવાની રહેશે અને તે બાબતની સેવાપોથીમાં અવશ્ય નોંધ કરવાની રહેશે.

- કર્મચારીનો ફાળો તેમજ તેના પર મળેલ વળતરની રકમ:
  - સરકારશ્રીના મુખ્ય સદર "૮૦૦૮" માં(પત્રક-ખ અનુસાર)
- સરકારશ્રીનો ફાળો તેમજ તેના પર મળેલ વળતરની રકમ:
  - ફાળો મુખ્ય સદર "૦૦૭૧-૦૧-૧૦૧-૦૧" માં
  - વળતર મુખ્ય સદર "૦૦૪૮-૦૪-૮૦૦-૦૧" માં

૩. નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કર્મચારીનો ફાળો અને તેના પર મળેલ વળતરને, સંબંધિત સામાન્ય ભવિષ્ય નિધિ(GPF) ખાતામાં જમા કરવાની કાર્યવાહી PROTEAN-CRA તરફથી રકમ પરત મબ્બા તારીખથી એક માસમાં પૂર્ણ કરવાની રહેશે.

૪. નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કર્મચારીનો ફાળો અને તેના પર મળેલ વળતરને જમા કરાવ્યા અંગેના ચલણાની નકલ એકાઉન્ટન્ટ જનરલશ્રીની કચેરી રાજકોટને મોકલવાની રહેશે.

આ સાથે નાણાકીય બાબતો અંગે સૂચનાઓ પત્રક-ક, કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ વિવિધ બજેટ સદર હેઠળ જમા લેવાની સૂચનાઓ પત્રક-ખ, આ સાથે સામેલ નમૂના મુજબ નિયત કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

*અધ્યક્ષ  
અધ્યક્ષ  
અધ્યક્ષ*

(આઈ. ડી. ચૌધરી)  
નાયબ સચિવ  
નાણા વિભાગ

#### નકલ રવાના:-

- માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજ્યપન, ગાંધીનગર.  
માન. મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર.  
માન. નાણા મંત્રીશ્રીના અંગત સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર.

માન. મંત્રીશ્રીઓ/રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ  
સચિવાલયના સર્વે વિભાગો/તમામ ખાતાના વડાઓ/તમામ કચેરીના વડાઓ

- સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર.
- સચિવશ્રી, ગુજરાત વિદ્યાનસલા સચિવાલય, ગાંધીનગર.
- રજીસ્ટ્રાર્શ્રી, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ.
- સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર.
- સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
- સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર.

તમામ કલેક્ટરશ્રીઓ, તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ  
એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ એન્ડ ઈ) ગુજરાત રાજ્ય, અમદાવાદ/રાજકોટ

એકાઉન્ટન્ટ જનરલશ્રી (ઓડિટ-૧, ૨), અમદાવાદ/રાજકોટ

નિયામકશ્રી, હિસાબ અને તિજોરી કચેરી, ગાંધીનગર.

નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, ગાંધીનગર.

નિરિક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી, ગાંધીનગર.

સર્વે જિલ્લા સહાયક નિરિક્ષકશ્રીઓ

તમામ તિજોરી અધિકારીઓ/તમામ પેટા તિજોરી અધિકારીઓ

પગાર અને હિસાબી અધિકારીઓ, અમદાવાદ/ગાંધીનગર.

સ્થાનિક ઓડિટ અધિકારી, અમદાવાદ/ગાંધીનગર.

તમામ બોર્ડ/કોર્પોરેશન/નિગમો

નાણા વિભાગના સર્વે અધિકારીશ્રીઓ

નાણા વિભાગની તમામ શાખાઓ

આઈ.ટી. કો-ઓફિનેટર, નાણા વિભાગ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી માટે

સિલેક્ટ ફાઈલ પેન્શન સેલ શાખા

- પત્ર છારા

માન. મંત્રીશ્રીઓ/રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ  
સચિવાલયના સર્વે વિભાગો/તમામ ખાતાના વડાઓ/તમામ કચેરીના વડાઓ

## પત્રક-ક (નાણાકીય બાબતો અંગે સૂચનાઓ)

તા.૦૮/૧૧/૨૦૨૪ ના ઠરાવ મુજબ પાત્રતા ઘરાવતા હોય તેવા કર્મચારી માટે અનુસરવાની  
કાર્યપદ્ધતિ

A. ઠરાવ પ્રસ્તિદ્ધ થયા અગાઉ જો કોઈ કર્મચારી/અધિકારી નિવૃત થઈ ગયેલ હોય અને તેઓના  
PRAN ખાતામાં જમા રકમનું આખરીકરણ ન થયેલ હોય તેવા કિસ્સામાં કરવાની થતી કાર્યવાહી

### 1. નિવૃત થયેલ કર્મચારી હ્યાત હોય તેવા કિસ્સામાં :-

જે કિસ્સામાં કર્મચારી નિવૃત થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીના PRAN ખાતામાં જમા રકમ પૈકી કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ નાણા વિભાગના તા.૦૩/૧૧/૨૦૨૩ના ઠરાવમાં જણાવ્યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરી કર્મચારીને ઓથોરીટીથી ચૂકવવાની રહેશે જ્યારે સરકારશ્રીના ફાળાની રકમ "૦૦૭૧-૦૧-૧૦૧-૦૧" સદ્રે તેમજ સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ "૦૦૪૮-૦૪-૮૦૦-૦૧" સદ્રે પરત જમા લેવાનું રહેશે. ત્યારબાદ તેઓને તા.૦૮/૧૧/૨૦૨૪ અને સદરહું ઠરાવને આધિન પેન્શનના લાભો ચૂકવવાના રહેશે.

### 2. નિવૃત થયેલ કર્મચારી હ્યાત ન હોય તેવા કિસ્સામાં :-

જે કિસ્સામાં કર્મચારી નિવૃત થઈ ગયેલ હોય અને ત્યારબાદ તે અવસાન પામેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીના PRAN ખાતામાં જમા રકમ પૈકી કર્મચારીના ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ નાણા વિભાગના તા.૦૩/૧૧/૨૦૨૩ના ઠરાવમાં જણાવ્યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરી કર્મચારીના વારસદારને ઓથોરીટીથી ચૂકવવાની રહેશે જ્યારે સરકારશ્રીના ફાળાની રકમ "૦૦૭૧-૦૧-૧૦૧-૦૧" સદ્રે તેમજ સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ "૦૦૪૮-૦૪-૮૦૦-૦૧" સદ્રે પરત જમા લેવાનું રહેશે. ત્યારબાદ તેઓને તા.૦૮/૧૧/૨૦૨૪ અને સદરહું ઠરાવને આધિન પેન્શનના લાભો ચૂકવવાના રહેશે.

B. ઠરાવ પ્રસ્તિદ્ધ થયા અગાઉ જો કોઈ કર્મચારી/અધિકારી નિવૃત થઈ ગયેલ હોય અને તેઓના  
PRAN ખાતામાં જમા રકમ અંગે આખરીકરણ (ચૂકવણું) થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં કરવાની  
થતી કાર્યવાહી

### 1. નિવૃત કર્મચારી હ્યાત હોય તેવા કિસ્સામાં :-

કર્મચારીને NPS અંતર્ગત ચૂકવવામાં આવેલ સરકારશ્રીના ફાળા તથા તેના પર મળેલ વળતર તથા સરકારશ્રીના ફાળા પર મેળવેલ માસિક/અર્ધવાર્ષિક/વાર્ષિક એન્યુઇટીની પ્રમાણસર રકમ પરત કરવા અંગે બાહેદરી પત્ર મેળવવાનું રહેશે.

### 2. નિવૃત થયેલ અધિકારી/કર્મચારીનું નિવૃત્તિ પછી અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં :-

જે કિસ્સામાં અધિકારી/કર્મચારી નિવૃત થઈ ગયેલ હોય અને ત્યારબાદ તે અવસાન પામેલ હોય તેવા કિસ્સામાં તેના વારસદારો જૂની પેન્શન યોજનામાં જોડાવવા માંગતા હોય તો તેઓની પાસેથી જૂની પેન્શન યોજના પરતવેનું વિકલ્પ મેળવી અધિકારી/કર્મચારીને/તેના વારસદારને NPS યોજના અંતર્ગત વસુલાત અંગેની કાર્યવાહી કરવી.

2024/08/11  
સાચાના

C. તા.૨૪/૦૯/૨૦૨૨ના ઠરાવ મુજબ કુટુંબ પેન્શનનો લાભ મેળવેલ હોય તેવા કિસ્સામાં અધિકારી/કર્મચારીના વારસદારોને માત્ર ગ્રેજ્યુઇટી તફાવતની રકમ ચુકવવાની રહેશે.

D. જે કર્મચારીઓ નવી વર્ધિત પેન્શન ચોજના હેઠળ નિવૃત થઈ ગયેલા હોય તેમજ તેઓના PRAN ખાતામાં જમા રકમ અંગેનું આખરીકરણ થઈ ગયેલ હોય તેવા કર્મચારીઓની વસુલાતપાત્ર રકમ અંગે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

1. વિભાગો/ખાતાના વડા દ્વારા તા.૦૮/૧૧/૨૦૨૪ના ઠરાવ મુજબ અધિકારી/કર્મચારીઓ તરફથી મળતા વિકલ્પના આધારે ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારીઓને ઠરાવનો લાભ આપવા અંગે કરેલ વિગતવાર હુકમોની નકલ તથા વિભાગ/કચેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ કુલ કેસોની એકત્રિત ચાદી તૈયાર કરી ઉક્ત ચાદી પણ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને મોકલી આપવાની રહેશે.
2. ચાદીમાં સામેલ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ નિવૃત થઈ ગયેલ હોય અને તેઓના PRAN ખાતામાં જમા રકમ અંગેનું ચુકવણું થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં તેઓને કુલ (Lump Sum સ્વરૂપે અને Annuity સ્વરૂપે) ચુકવાયેલ રકમ પૈકી સરકારશ્રીના હિસ્સાની પરત કરવાની થતી રકમ અંગે PRAN નંબર વાઈઝ વસૂલાતપાત્ર રકમની ચાદી તૈયાર કરી નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ સંબંધિત વિભાગને આપવાની રહેશે અને સંબંધિત કચેરી/વિભાગ વસૂલાતપાત્ર રકમ સરકારશ્રીમાં પરત લેવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.
3. ઉક્ત ચાદીમાં સામેલ કર્મચારી દ્વારા એન.પી.એસ ફંડની રકમમાંથી ખરીટેલ એન્યુઇટીની પોલીસી અન્યથે મેળવેલ માસિક/અર્દવાર્ષિક/વાર્ષિક એન્યુઇટીની રકમ પૈકી સરકારશ્રીના ફાળાના પ્રમાણમાં મળેલ એન્યુઇટીની રકમ વસૂલાતપાત્ર રકમ તરીકે ગણતરી તરીકે દ્યાનમાં લેવાની રહેશે.

E. NPS અંતર્ગત ચુકવવામાં આવેલ રકમની વસૂલાત નીચે મુજબ કરવાની રહેશે. ઉક્ત કર્મચારીઓના કિસ્સામાં નીચે મુજબ સરકારશ્રીના ફાળાની રકમ વસૂલાત પેટે લેવાની રહેશે.

- i) સંબંધિત કચેરી/HOD એ નિવૃત કર્મચારીઓના પેન્શન પેપર્સ તૈયાર કરતી વખતે નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીની વેબસાઈટ <http://dppf.gujarat.gov.in> પરની ચાદીની ચકાસણી કરી, આવા કેસમાં કર્મચારીને ચુકવવામાં આવેલ રકમ પૈકીની સરકાર પક્ષે પરત લેવાપાત્ર સરકારશ્રીના ફાળાની રકમ "૦૦૭૧-૦૧-૧૦૧-૦૧" સંદરે તેમજ સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ "૦૦૪૮-૦૪-૮૦૦-૦૧" સંદરે પરત જમા કરાવી સરકારી સંદરે પરત લેવાની રહેશે.
- ii) જે કેસમાં કર્મચારીને ગ્રેજ્યુઇટી ચુકવવામાં આવી ન હોય તે કેસમાં પરત લેવાપાત્ર રકમ ગ્રેજ્યુઇટીની ચુકવવાપાત્ર રકમમાંથી સરખર કરવાની રહેશે.
- iii) કર્મચારીને મળવાપાત્ર પેન્શન એરીયર્સની રકમ સામે સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ સરખર કરવાની રહેશે.

- iv) ઉક્ત મુજબના વિકલ્પ-(ii), (iii) પૈકીના એક અથવા એકથી વધુ વિકલ્પોનો ઉપયોગ કરી સરકારી હિસ્સાની રકમ પરત લઈ શકાશે.
- v) ઉપરના તમામ વિકલ્પો-(ii),(iii),(iv) મુજબ કાર્યવાહી બાદ પણ જો સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ બાકી રહે તો પેન્શાન પર મળવાપાત્ર હુંગામી વધારા (T.I) માંથી સરભર કરવાની રહેશે.

24/12/2016

**પત્રક-ખ (કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ જમા)**

ક્રમ નં	કર્મચારીનો સંવર્ગ	GPF અંગેના હિસાબો નિભાવનાર સંસ્થા	Protean-CRA દ્વારા પરત મળેલ રકમ પૈકી કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ જમા કરાવવા અંગેનું સદર તેમજ તે અંગેની કાર્યવાહી
૧	વર્ગ-૧, ૨, ૩ના સરકારી કર્મચારીઓ	એકાઉન્ટન્ટ જનરલની કચેરી, રાજકોટ	સરકારશ્રીના મુખ્ય સદર "૮૦૦૮-૦૧-૧૦૧-૦૧" માં ચલણાથી તબદીલ કરવાના રહેશે.
૨	વર્ગ-૪ ના કર્મચારીઓ	નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી, ગાંધીનગર	વર્ગ-૪ ના ડિસામાં સરકારશ્રીના મુખ્ય સદર "૮૦૦૮-૦૧-૧૦૧-૦૨" માં ચલણાથી તબદીલ કરવાના રહેશે.
૩	પંચાયત/ગ્રાન્ટ ઈન એટ્ડ સંસ્થાના કર્મચારીઓ	<ul style="list-style-type: none"> <li>● પંચાયત</li> <li>● જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી</li> <li>● ઉર્દ્ય શિક્ષણ કમિશનરની કચેરી</li> <li>● અન્ય સામાન્ય ભવિષ્યનીધિના હિસાબો નિભાવનાર સંસ્થા</li> </ul>	નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી દ્વારા બેંક પાસેથી તબદીલ કરવાપાત્ર રકમનો ડિમાન્ડ ફ્રાફ્ટ મેળવી જે-તે સંસ્થાને મોકલી આપવાનો રહેશે ત્યારબાદ આ રકમ જે તે પંચાયત/સંબંધિત કચેરી તેમના P.L.A. માં જમા કરાવી રકમ કર્મચારીના <b>GPF</b> જાતામાં જમા કરાવવાની રહેશે.

સાચાની -

## **પત્રક-ગ(બાહેદરીના નમૂના)**

નાણા વિભાગ, ગુજરાત સરકારના ઠરાવ કમાંક નવપ/૧૦/૨૦૨૦/ઓ-૫૪૦/પી, તા.૧૯/૦૪/૨૦૨૫  
અન્વયે જૂની પેન્શન ચોજનાની પાત્રતા ઘરાવતા કર્મચારીઓ માટે આપવાનું થતું બાહેદરી પત્રક

### **બાહેદરી પત્રક-૧**

હું શ્રી/શ્રીમતિ..... તા.....  
ના રોજ વચ્ચનિવૃત થયેલ છુ તેમજ મને મારા PRAN..... ખાતામાં જમા  
રકમનું આખરી ચૂકવણું થયેલ છે. નાણા વિભાગના ઠરાવ કમાંક નવપ/૧૦/૨૦૨૦/ઓ-  
૫૪૦/પી તા. ૦૮/૧૧/૨૦૨૪ અન્વયે મારો સમાવેશ જૂની પેન્શન ચોજના અંતર્ગત થયેલ હોઈ,  
મને NPS અંતર્ગત ચૂકવાયેલ રકમ પેકી સરકારશ્રીનો ફાળો તેમજ તેના પરના વળતર તથા  
સરકારશ્રીના ફાળા પર મળેલ એન્યુઇટીની રકમ મને મળવાપાત્ર નિવૃત્તિ વિષયક લાભોમાંથી  
સરકારશ્રીમાં વસૂલાત તરીકે પરત લેવા બાહેદરી આપુછું.

કર્મચારીની સહી:-.....

કર્મચારીનું પૂરુણ નામ : -.....

હોક્કો : -.....

પ્રમાણિત કર્યું .....

(ઉપાક અને ચૂકવણા અધિકારી/ખાતાના વડા)

નાણા વિભાગ, ગુજરાત સરકારના ઠરાવ કમાંક નવપ/૧૦/૨૦૨૦/ઓ-૫૪૦/પી, તા.૧૬/૦૪/૨૦૨૫  
અન્વયે જૂની પેન્શન યોજનાની પાત્રતા ઘરાવતા કર્મચારીઓ જે નિવૃત્તિ પછી અવસાન પામેલ હોય તેમના  
વારસદારોએ આપવાનું થતું બાહેદરી પત્રક

## બાહેદરી પત્રક-૨

હું  
શ્રી/શ્રીમતિ.....

..  
મારા.....(પતિ/પતની/પુત્ર/પુત્રી/આશ્રિત માતા/પિતા) સ્વ.શ્રી.....

.....કે જેઓ તા.....ના રોજ  
વચનિવૃત થયેલ હતાં, તેઓનું તા.....ના રોજ અવસાન થયેલ છે. તેઓના  
એન.પી.એસ અંતર્ગત PRAN.....ખાતામાં જમા રકમનું આખરી ચૂકવણું  
થયેલ છે. નાણા વિભાગના ઠરાવ કમાંક નવપ/૧૦/૨૦૨૦/ઓ-૫૪૦/પી તા.  
૦૮/૧૧/૨૦૨૪  
અન્વયે  
સ્વ.શ્રી.....નો

સમાવેશ જૂની પેન્શન યોજના અંતર્ગત થયેલ છે જેથી સ્વ.શ્રી.....ને અથવા  
તેઓના વારસદારને એન.પી.એસ અંતર્ગત ચૂકવાયેલ રકમ પૈકી સરકારશ્રીનો ફાળો તેમજ તેના પરના  
વળતરની રકમ તથા સરકારશ્રીના ફાળા પર મળેલ એન્યુઈટીની રકમ મને મળવાપાત્ર નિવૃત્તિ વિષયક  
લાભોમાંથી સરકારશ્રીમાં વસ્તુલાત તરીકે પરત લેવા બાહેદરી આપુછું.

કર્મચારીની સહી:-.....

કર્મચારીનું પૂરુ નામ :-.....

હોદ્દો:-.....

પ્રમાણિત કર્યુ .....  


(ઉપાડ અને ચૂકવણા અધિકારી/ખાતાના વડા)

## પત્રક-૪

ગુજ. પ્ર. ક. પ. (માર્ગ.)  
૪૧૮૮૯. અને જ. (શાહેર)

### Application for admission to the પ્રોવિન્સ ફંડમાં જીવિત ભાગેની અરજી

**to be submitted to duplicate**  
(એ. -નક્સો મોકલેથી)

Name of Applicant	Official Designation	Office to which attached if on deputation state the parent Dept. Govt also	Service to which the applicant belongs	Whether applicant's service is pensionable or not	Whether the applicant is permanent temporary or re-employed if temporary give the date of commencement or service	Date of emolument per mensem	Rate of subscription per mensem	If subscribe to any other fund the name of such fund	whether the applicant has a family or not	Account number to be allotted by the Accounts office	Remarks
અરજદારનું જાન	લોકી	કઈ કોરેચાં છે ? ગુજરાત પર હોય તે મુજબ ખાતા નેમજ અરજદારની વિના કરશુદ્ધ	અરજદાર કઈ સેવામાં છે	અરજદારની નોકરીએનું પણ છે કે નું	અરજદાર કાયળી હોવાની કે કરી નોકરીમાં લેવાયેલ છે ? હંગામી હોય તો નોકરી થાકું કચ્છની લારીએ દેખાતાં	અજાતરની માસિક આપક	અજાતરની માસિક આપક	બીજા કોઈ કર્મા અચાનકાર દોષ તો તે કંઠનું નામ દરમાવનું	અરજદાર કુટુંબ ઘરાંથે કે કે	અરજદાર કુટુંબ ઘરાંથે કે કે	વિશેષ નોંધ
૧.૧	૨.૨	૩.૩	૪.૪	૫.૫	૬.૬	૭.૭	૮.૮	૯.૯	૧૦.૧૦	૧૧.૧૧	૧૨.૧૨

A form of nomination in the prescribed form duly filled in is enclosed

Station _____	Date _____	the _____
તારીખ _____	નંબર _____	૨૦૦ _____
Enclosure _____		
જાગ્રાત _____		

No. \_\_\_\_\_ Date \_\_\_\_\_ the \_\_\_\_\_  
નંબર \_\_\_\_\_ તારીખ \_\_\_\_\_ ૨૦૦ \_\_\_\_\_

Returned with account number allotted This number should be quoted in all correspondence connected there with

- \* Information regarding date of birth should be given in Column 12
- \* જન્મ તારીખને લગતી માટી નંબર ૧૨માં આપવી.

Signature of Head Office  
કેરેના વાણી જીવી  
(Designation)  
(હોદી)

Signature of Applicant  
અરજદારની જાન  
(હોદી)

નિયત કોઈ મુજબ અરજદાર બાબતનું નિયમ કોઈ આ સાહે આગેલ છે.

Signature (અધી)  
Designation (હોદી)

### **Form-A**

#### OPTION TO AVAIL BENEFITS OF PENSION SCHEME UNDER GUJARAT CIVIL SERVICES (PENSION) RULES 2002

- I, ..... hereby elect option to avail benefits of pension scheme under Gujarat Civil Services (Pension) Rules, 2002 or in case of Non-Government Grant in aid institutions Pensionary benefits as applicable / Notified by various administrative departments with the approval of Finance Department.

Signature of Government/Non-Government  
servant/Subscriber  
Name .....  
Designation .....  
Office in which employed.....  
Mobile No. .....

Place and date: .....

This option supersedes any other option made by me earlier.

**(To be filled in by the Head of Office or authorized Gazetted Officer)**

Received the option dated....., under Gujarat Civil Services (Pension) Rules, 2002 or in case of Non-Government Grant in aid institutions Pension benefits as decided by various administrative departments with the approval of Finance Department made by Shri/Smt./Kumari.....,

Designation.....Office.....

.....

Entry of receipt of option has been made in page .....Volume.....of Service Book.

Signature,

Name and Designation of Head of Office or authorized Gazetted Officer with seal

Date of receipt.....

The receiving Officer will fill the above information and return a duly signed copy of the complete Form to the Government servant who should keep it in safe custody so that it may come into the possession of the beneficiaries in the event of his/her death/ invalidation.

# સામાન્ય નિયુક્તિ ફોર્મ - ૧

(ના. નિ. સ. છ. ક્રમાંક : ડીપીપી-૧૦૮૮-૪૬૬-૮૪૫ (૪)-પી, તા. ૨૩-૬-૨૦૦૦નો ફક્રો-૩)

## (કર્મચારીને કુટુંબ હોય ત્વારે આપવાનું)

આ ફોર્મનું પૃષ્ઠ - ૨ આ પૃષ્ઠની પાછળ જ છાપેલું હોય જોઈએ

..... ની કચેરીમાં .....

હીં ઉપરે ક્રમાંક લખીની હું ..... આથી  
નીચે જુદ્ધાંશું પ્રયોગી રીતે કર્મચારીને ચૂકવવાપાત્ર થાય તે પહેલાં અથવા ચૂકવવાપાત્ર થઈ હોય પણ ચૂકવવામાં આવી ન હોય અને  
મારું અવસાન થાય તે પ્રયોગી રીતે કર્મ મારા કુટુંબના નીચેના સલ્યોને મળે તેવી નિયુક્તિ કરું છું. :-

૧. સામાન્ય ભવિષ્ય નિયિ નિયમો હેઠળના મારા ભવિષ્ય નિયિ ખાતામાં જમા હોય તે રકમ.
૨. જૂથ વિભા પોઝિશન હેઠળ મણવાપાત્ર રકમ.
૩. સુધારેલા પેન્શનના નિયમો હેઠળ મળવાપાત્ર પેન્શન, ગ્રેચ્યુઅર્ટી, મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઅર્ટી અને રૂપાંતર પેન્શનની રકમ
૪. અવસાન સમયે લેણી બાને મળવાપાત્ર પગાર અને ભથ્થાની રકમ

આ નિયુક્તિની તારીખ પહેલાં આપેલી નિયુક્તિ / નિયુક્તિઓ રુદ્ધ ગણવા વિનંતી.

ક્રમ	નિયુક્તિ / નિયુક્તિઓનું નામ અને પુરુષ સરનામું	બચતદાર સાથેનું સગપણ	નિયુક્તાની ઉંમર અને જન્મ તારીખ	દરેક નિયુક્તને આપવાપાત્ર હિસ્સો (ટકામાં)	જે આકસ્મિક ઘટના બનતાં નિયુક્તિપત્ર અમાન્ય હરે તે આકસ્મિક ઘટના	બચતદારની પહેલાં નિયુક્તનું મૃત્યુ થાય તેવા પ્રસંગે નિયુક્તિનો હક્ક જે વ્યક્તિ / વ્યક્તિઓને મળે તેમના નામ, સરનામું અને સગપણ	દરેક નિયુક્તને આપવાપાત્ર હિસ્સો (ટકામાં)
૧							
૨							
૩							
૪							
૫							

અનુયાયી પાછળના પૃષ્ઠ ઉપર

સામાન્ય નિયુક્તિ ફોર્મ - ૧ (પૃષ્ઠ - ૨)

(કર્મચારીને કુટુંબ હોય ત્યારે આપવાનું)

ક્રમ	નિયુક્તિ નિયુક્તાનું નામ અને પુરુષ સરનામું	બચતદાર સાથેનું સંગપજ્ઞ	નિયુક્તાની ઉંમર અને જન્મ તારીખ	દરેક નિયુક્તને આપવાપાત્ર હિસ્સો (ટકામાં)	જે આકસ્મિક ઘટના બનતાં નિયુક્તિપત્ર અમાન્ય હરે તે આકસ્મિક ઘટના	બચતદારની પહેલાં નિયુક્તાનું મૂલ્ય થાય તેવા પ્રસંગે નિયુક્તનો હક્ક જે વ્યક્તિ / વ્યક્તિઓને મળે તેમના નામ, સરનામું અને સંગપજ્ઞ	દરેક નિયુક્તને મળવાપાત્ર હિસ્સો (ટકામાં)
૧			૩	૪	૫	૬	૭
૭							
૮							
૯							
૧૦							

સન ..... ના ..... મહિનાની ..... તારીખ

(૧) બચતદારની સહી

બે સાથીઓની સહી

(૨) (ખોટા અસરોમાં નામ)

નામ	સરનામું	સહી
(૧).....	(૧).....	(૧).....
(૨).....	(૨).....	(૨).....

કચેરીના વડાની સહી અને છોલી  
કચેરીનો સિક્કો

નોંધ: કર્મચારીએ નોકરી દરમ્યાન જે નિયુક્તિમાં ફેરફાર કરી શકશે અને તે પ્રસંગે તેની નવી નિયુક્તિ આપવાની રહેશે.  
નવી નિયુક્તિ કચેરીમાં મળ્યા બાદ તેના ઉપર કચેરીના વડાની સહી થયે તે અમલમાં આવશે અને ત્યારખાદ તેને સર્વિસ  
બુકમાં ચોટાડવાની રહેશે.